

## અમોને મોક્ષ મળતો'તો

અમોને મોક્ષ મળતો'તો, છતાં રોકાઈ જ્યાં જાણી;  
અમારી ભાવના જ હતી, જગત્કલ્યાણ કરવાની.

અમે ખુદ મોક્ષ રોક્યો'તો, 'વ્યવરિથત' શોધને કાજે;  
અબજ વર્ષો જે ગુપ્ત હતું, તે નીકળ્યું વિશ્વમાં આજે.

અનાદિથી પરાપૂર્વે કરું છું 'હું' જ એ ભાંતિ;  
સમજની ઊંઘી સમજાણથી, દૂબી વિભાવમાં આંટી.

ઇ તત્ત્વોનું જ સંમેલન, મિલનમાં ગુપ્ત વિસર્જન;  
પ્રતિજીદિત આતમા કર્તાપદે બેસી કરે સર્જન.

પ્રયોગે કર્તાપદનું ભાન, પ્રયોગી સ્વરૂપે વિભાંત;  
સ્વયંભૂ યા જ સર્વજ્ઞ, અકર્તાપદથી દ્યે નિજભાન.

'કરે છે કોણ ?' એ સમજે, તો ઉકલે કાયમી કોયડો;  
કરામત પુરગલી બાજુ, સ્વાભાવિક જ્ઞાન-નેત્રે જો.

અતિ મુશ્કેલ સમજાવું, વિના 'સર્વજ્ઞ'ની કિરપા;  
સરળને સહેજે સમજાયું, અપીડ 'આ' મોક્ષસુખ-સંપદા.

ખૂણેખૂણો સકલ બ્રહ્માંડનો હું જોઈને કહું છું;  
'નથી ભગવાન કોઈ કર્તા, જગત આખું સ્વયંભૂ થયું.'

છું ઈતિહાસેય હું અજોડ, જગતમાં મૂળ હું પરથમ;  
જિનેશ્વરી મૂર્ત 'આ' 'અક્રમ', પહોંચ્યું આજ છે વિક્રમ.

અનંતા યુગમાં અપવાદ, પ્રગટ પ્રત્યક્ષ મૂળ ભગવન્દ;  
જગતને ખુલ્લેઆમ કહ્યું : હું કારણ અગૃહુ-લઘુતમ.

